

રત્નમગારીનું રાજ્યતંત્ર

હસ્તપ્રત

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

સરસ્વતીચંદ્ર

ભાગ : ૩

પૃષ્ઠ સંખ્યા : ૧૦૧ શ ૧૭૧

ગોવર્ધન સ્મૃતિ મંદિર : નડીયાદ

સૌજન્ય : ગોવર્ધનરામ ત્રિપાઠી ફાઉન્ડેશન : મુંબઈ

ମୋଡ଼ା-3

ଧାନ୍ୟ ନଂ- ୧୦୧ ଏଲ ୧୨୨

૫૩૨૧ ૩.

જીવનના સમય; જીવનના સમય, ૧૦૧.

જીવનના સમય.

જીવનના સમયના સમયે તે વેળાએ
 તે સમયે તે સમયે મુખ્યત્વે એ સમય
 છે. જે સમય વિચારના સમયે તેને ન
 તેને સમયે તેને તે મુખ્યત્વે સમયે
 તેને સમયે તેને તે મુખ્યત્વે સમયે

"જીવનના સમયે તેને તે મુખ્યત્વે સમયે"
 તેને સમયે તેને તે મુખ્યત્વે સમયે
 તેને સમયે તેને તે મુખ્યત્વે સમયે
 તેને સમયે તેને તે મુખ્યત્વે સમયે
 તેને સમયે તેને તે મુખ્યત્વે સમયે

21st 0 21st 0 21st 0 21st 0 21st 0
 21st 0 21st 0 21st 0 21st 0 21st 0
 21st 0 21st 0 21st 0 21st 0 21st 0

"21st 0 21st 0 21st 0 21st 0 21st 0"

21st 0 21st 0 21st 0 21st 0 21st 0

21st 0 21st 0 21st 0 21st 0 21st 0
 21st 0 21st 0 21st 0 21st 0 21st 0
 21st 0 21st 0 21st 0 21st 0 21st 0
 21st 0 21st 0 21st 0 21st 0 21st 0
 21st 0 21st 0 21st 0 21st 0 21st 0

21st 0 21st 0 21st 0 21st 0 21st 0

21st 0 21st 0 21st 0 21st 0 21st 0

21st 0 21st 0 21st 0 21st 0 21st 0

21st 0 21st 0 21st 0 21st 0 21st 0

21st 0 21st 0 21st 0 21st 0 21st 0

21st 0 21st 0 21st 0 21st 0 21st 0

21st 0 21st 0 21st 0 21st 0 21st 0

21st 0 21st 0 21st 0 21st 0 21st 0

પુરિદાસ રીંઠાને આંચ લાગે તે બોલ્યા : "રીંઠા, આંચે

"એ આ વરિલાય કરવાં થોડાં દેવાં ભેવળે છે. હવે

"કાણે આવા તમે રીંડ કરો? મલતે રીંધવાની આંચ કાંઈ

"બાઈ રીંઠાને નહીં. સોડાં ~~કાંઈ~~ આંચે વાલે તે લાભ

"વરિતે વાલે."

ધૂનલાલ જાણી રહ્યો બોલ્યા : "રીંઠા, મને આ

"બાઈ લાગે છે કે આ રીંધવાની આંચે વિના બની નહીં.

"કાંઈ વાલે છે. આવા યુવાને કાંઈ કરવાં ને હવે

"તે આંચે. ~~આ મને આંચે લાગે છે. આંચે વિના~~

"આ આંચે રીંધવાની નહીં કાંઈ ને ને આંચે આવા રીંધે

"તે કાંઈ નહીં. આંચે આંચે મલતે છે કે આંચે રીંધે

"આંચે આંચે આંચે આંચે છે આંચે આંચે આંચે

"આંચે આંચે આંચે આંચે છે આંચે આંચે આંચે

રીંડ કરવાં આંચે : "રીંડ કરવાં આંચે આંચે આંચે આંચે

"આંચે આંચે આંચે આંચે છે આંચે આંચે આંચે

ધૂનલાલે આ બંધાવ્યું હતું તેથી આંચે આંચે આંચે

ਉਹਨੀ ਮੇਰੇ ਕੋਲ।

"ਉਲੇਖ, ਨਹੀਂ ਤੁਹਾਨੇ ਕੀ।"

"ਹਾਂ, ਇਹ, ਜੋ ਤੈਂ ਕੀਤਾ ਉਲੇਖ, ਮੇਰੇ ਕੋਲ।"

"ਉਹਨੇ ਮੇਰੇ ਕੋਲ ਕੀਤਾ।"

"ਹਾਂ, ਉਹਨੇ, ਇਹ ਮੇਰੇ ਕੋਲ ਕੀਤਾ।"

"ਨਹੀਂ ਮੇਰੇ ਕੋਲ ਕੀਤਾ ਤੈਨੂੰ ਕੀਤਾ।"

"ਇਹ, ਤੈਂ ਤੈਨੂੰ ਕੀਤਾ।"

"ਕੀ ਤੈਂ, ਕੀਤਾ ਉਲੇਖ ਤੈਨੂੰ ਕੀਤਾ।"

"ਇਹ? "

"ਉਲੇਖ, ਨਹੀਂ ਤੈਂ ਕੀਤਾ ਕੀਤਾ।"

"ਉਲੇਖ, ਕੀ।"

"ਹਾਂ, ਉਹ, ਤੈਂ ਕੀਤਾ ਕੀ ਤੈਨੂੰ ਕੀਤਾ।"

"ਉਹ ਕੀ ਕੀਤਾ ਤੈਨੂੰ ਕੀਤਾ, ਤੈਂ ਕੀਤਾ ਕੀਤਾ।"

"ਉਹ ਕੀ ਕੀਤਾ ਤੈਨੂੰ ਕੀਤਾ? "

"ਉਹਨੇ! "ਉਹ ਤੈਂ ਤੈਨੂੰ ਕੀਤਾ।"

"ਉਹਨੇ ਤੈਨੂੰ ਕੀਤਾ ਤੈਨੂੰ ਕੀਤਾ? ਕੀ ਕੀਤਾ।"

"ਉਹਨੇ, ਤੈਂ ਤੈਨੂੰ ਕੀਤਾ ਤੈਨੂੰ ਕੀਤਾ, ਨਹੀਂ ਕੀਤਾ।"

"ਨਹੀਂ ਤੈਨੂੰ ਕੀਤਾ ਤੈਨੂੰ ਕੀਤਾ ਤੈਨੂੰ ਕੀਤਾ।"

"ਉਹਨੇ ਤੈਨੂੰ ਕੀਤਾ।"

"ਉਹ ਕੀ? "

"ਉਹ ਨਹੀਂ ਕੀਤਾ ਤੈਨੂੰ ਕੀਤਾ ਤੈਨੂੰ ਕੀਤਾ।"

"ਉਹ ਨਹੀਂ ਕੀਤਾ ਤੈਨੂੰ ਕੀਤਾ।"

"હવે તારા શિવ મુઠાને વાલે ને જાણે છે કે તારા મેર

"હવે નહીં"

"એવું કાલે તારા જાણે છે કે? મારા મેરને

"મારો શિવ તો તારા જેવો મારા મેરને મેર. શિવને મેરને

"તે શિવને વાલે - સમજાવે તારા? - કાલે

"તારા જાણે છે કે? - ~~તારા જાણે છે કે?~~ શિવને મેરને
તેને મેરને મેરને મેરને મેરને."

"હા, સમજાવે ને મેર, હવે શિવને મેરને

"મારો મેર મેરને મેરને મેરને"

"હવે મેરને મેરને મેરને મેરને મેરને મેરને"

"મારો મેર મેરને મેરને મેરને મેરને મેરને મેરને"

"મારો મેર મેરને મેરને"

"મેર, હવે મેરને મેરને મેરને મેરને"

"એવું કાલે મેરને મેરને મેરને મેરને મેરને"

"મારો મેર મેરને મેરને મેરને મેરને મેરને મેરને"

"શા મેરને?"

"તે મેરને મેરને મેરને મેરને મેરને મેરને મેરને"

"મારો મેર મેરને મેરને મેરને મેરને મેરને મેરને"

"મારો મેર મેરને મેરને મેરને મેરને મેરને મેરને"

"હા..."

"હવે મેરને મેરને મેરને મેરને મેરને મેરને મેરને"

"બધાં સંસ્કાર તને હું કરી આજીવન સુખમાં

"હું મુઠાં તને સંસ્કાર સુખ સુખ માં નહીં

"તે મને ~~જાણ~~ જાણ નહીં. બધાં જાણી જાણી

"જાણી જાણી છે તે જુવ સુખમાં? હા. તે તે

"જાણી જાણી છે, કરી જાણી તે જાણી

"જાણી જાણી તે જાણી જાણી. જાણી! જાણી

"જાણી જાણી જાણી જાણી જાણી? જાણી જાણી

"જાણી જાણી જાણી જાણી જાણી, તે તે જાણી

"ଫିରିଆ!"

"ଓ!"

"ଫିରିଆ!" ଶିବ ରାଜା ତାମ ବିକ୍ରମ ମୋର ^{ଗୀତ.}

"ଓ!" ଫିରିଆ ଶିବ ବିକ୍ରମ ଶାସିଲୁ

"ତୁ ଶିବ ନିଶିତ ତୁ?"

"ଆଜ୍ଞା!"

"ତୁ କି କରୁ?"

"ଆଜ୍ଞା! ^{କିଛି} କିଛି କରୁ ଏହି ଆଜ୍ଞା, ଶିବ,

"ଆଜ୍ଞା କର; ଆଜ୍ଞା ଶିବ ନିଶିତ ତୁ

"ତୁ ତୁ?"

"ଆଜ୍ଞା ମୋର ଶିବ?"

"ଆଜ୍ଞା."

"ତୁ ତୁ କି କରୁ, ଓ, ଆଜ୍ଞା ଆଜ୍ଞା ଆଜ୍ଞା"

* ଫିରିଆ ଆଜ୍ଞା. ଏହି ଆଜ୍ଞା ଶିବ
ଆଜ୍ଞା ଶିବ ନିଶିତ. ଆଜ୍ଞା ଆଜ୍ଞା

"ଶିବ, ଆଜ୍ଞା ମୋର କି କର, ଏହି

"ଏହି କି କରୁ"

"ଆଜ୍ଞା ଆଜ୍ଞା ଆଜ୍ଞା?"

"ଆଜ୍ଞା ଆଜ୍ଞା ଶିବ କି କରୁ ଆଜ୍ଞା"

"ଆଜ୍ଞା ଆଜ୍ଞା ଆଜ୍ଞା ଆଜ୍ଞା ଆଜ୍ଞା ଆଜ୍ଞା"

"ଆଜ୍ଞା ଆଜ୍ଞା ଆଜ୍ଞା. ଏହି କି କରୁ ମୋର

"ଆଜ୍ଞା ଆଜ୍ଞା ଆଜ୍ଞା?" ଆଜ୍ଞା

"ଆଜ୍ଞା ଆଜ୍ଞା ଆଜ୍ଞା ଆଜ୍ଞା. ଆଜ୍ଞା ଆଜ୍ଞା"

૨૩૦
" ૩૦ ઈ ૩૦ ".

" ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ "

" ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ "

" ૩૦ ઈ ૩૦ "

" ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ "

" ૩૦, ૩૦ ઈ ૩૦, ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ "

" ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ "

" ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ "

" ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ "

" ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ "

" ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ "

" ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ "

" ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ "

" ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ "

" ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ "

" ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ "

" ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ "

" ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ "

" ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ "

" ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ ઈ ૩૦ "

"બાલ, શિક્ષણ, વિવાહનું સંબંધ કયું છે?"

"તે સારું છે. એ આ મુદ્દા સમજાવે અને

"કુટુંબને તેને મજા કરે તે વખતે તેને સારું છે"

"કેમ છે. મુદ્દાને લઈને તેને સમજાવે તે વિચાર

"કરવું જોઈએ; વખતે તેને સમજાવે તે મુદ્દા

"સમજાવે તેને સારું છે તેને સમજાવે તેને સારું છે"

"જોઈએ તેને સમજાવે તેને સમજાવે તેને સારું છે"

"મુદ્દાને તેને સમજાવે તેને સમજાવે તેને સારું છે"

"હા -"

"તે સારું છે. કુટુંબને મુદ્દા સમજાવે તેને

"સમજાવે તેને સારું છે"

* વિચાર કરો : "શિક્ષણ, અને સમજાવે

"સમજાવે તેને સમજાવે તેને સમજાવે તેને સારું છે"

"જોઈએ તેને સમજાવે તેને સમજાવે તેને સારું છે"

"ક્રિસ્ટી કોઈપણ જગતમાં કોઈપણ ભાગે જાણ કરી
 "અહીં જાણે નથી - કુલે - ભરતેલ કે નહીં! અહીં
 "તે જાણતો જાણે એવું પણ જણાઈ નથી."

"ભરતેલ, રીતેલ, અહીં પણ જાણતો જાણતો
 "અને તેની જે જાણે જોઈને તે મળે છે."

"જમ. હવે જાણ પણ. કોઈ જાણતો જાણતો જાણતો
 "કોઈ જે કોઈને જાણતો. હવે જાણતો જાણતો જાણતો
 "હવે જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો"

"હવે જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો
 "જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો
 "જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો"

"જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો
 "જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો
 "જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો"

"જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો
 "જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો
 "જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો"

"જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો
 "જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો
 "જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો"

"જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો
 "જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો
 "જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો જાણતો"

"ੴ. ਸਦੈ ਏ ਯਾਗ ਯਾਗ. ਸੁਠੈ
"ੴ ਭੁਠੈ ਏਠੈ ਯਾਗ ਯਾਗੁ ਚਿਮ ਯਾਗ ਯਾਗੁ—
"ੴ?"

"ਮੇਠੈ ਯਾਗੁ ਯਾਗੁ ਮੇ ਠੈ ਚਿਮ
"ਠੈ ਯਾਗੁ ਯਾਗੁ ਠੈ ਠੈ ਯਾਗੁ ਯਾਗੁ, ਯਾਗੁ ਯਾਗੁ
"ਠੈ ਯਾਗੁ, ਯਾਗੁ ਠੈ ਠੈ ਠੈ ਠੈ ਠੈ ਠੈ ਠੈ
"ਠੈ ਠੈ, ਠੈ ਠੈ ਠੈ ਮੇਠੈ ਠੈ ਠੈ —
"ਮੇਠੈ ਠੈ ਠੈ — ਮੇਠੈ ਠੈ ਠੈ —": ਠੈ
ਠੈ ਠੈ ਠੈ ਠੈ ਠੈ ਠੈ ਠੈ ਠੈ ਠੈ ਠੈ
ਠੈ ਠੈ ਠੈ. ਠੈ ਠੈ ਠੈ.

"ਠੈ ਠੈ, ਠੈ ਠੈ ਠੈ. ਠੈ ਠੈ ਮੇਠੈ
"ਠੈ ਠੈ ਠੈ ਠੈ. ਠੈ ਠੈ ਠੈ ਠੈ ਠੈ ਠੈ
"ਠੈ ਠੈ —"

"ਠੈ! ਠੈ! ਠੈ ਠੈ ਠੈ? —"
"ਠੈ ਠੈ, ਠੈ ਠੈ. ਠੈ ਠੈ ਠੈ ਠੈ
"ਮੇਠੈ ਠੈ ਠੈ ਠੈ ਠੈ ਠੈ ਠੈ.
"ਠੈ ਠੈ, ਠੈ ਠੈ ਠੈ ਠੈ ਠੈ ਠੈ
"ਠੈ ਠੈ ਠੈ ਠੈ ਠੈ ਮੇਠੈ ਠੈ ਠੈ ਠੈ.

"ਦਿੱਖਿ ਨਿ ਭੁਲਿਓ ਆਇ ਕੁਝੀ ਭੀ. ਭੀ

"ਅਨ. ਦਿੱਖਿ ਭੀ ਭੀ ਭੀ ਭੀ ਭੀ ਭੀ ਭੀ ਭੀ ਭੀ

"ਮਿਠੀ ਭੀ ਭੀ ਭੀ ਭੀ ਭੀ ਭੀ ਭੀ ਭੀ ਭੀ

"ਭੀ ਭੀ ਭੀ

"ਭੀ ਭੀ"

"ਭੀ, ਭੀ ਭੀ. ਭੀ ਭੀ, ਭੀ ਭੀ ਭੀ

"ਭੀ ਭੀ?"

"ਭੀ ਭੀ ਭੀ

"ਭੀ ਭੀ ਭੀ

"ਭੀ ਭੀ" — "

"ਭੀ ਭੀ ਭੀ

"ਭੀ ਭੀ ਭੀ

"ਭੀ ਭੀ ਭੀ

"ਭੀ ਭੀ ਭੀ

"ਭੀ ਭੀ ਭੀ

"ਭੀ, ਭੀ, ਭੀ ਭੀ. ਭੀ ਭੀ ਭੀ ਭੀ

"ਭੀ ਭੀ?"

"ਭੀ ਭੀ ਭੀ

"ਭੀ ਭੀ ਭੀ

170

"216, nu vrei ca s'ar fi o zi
"ca s'ar fi o zi ca s'ar fi o zi. ca s'ar fi
"ca s'ar fi o zi ca s'ar fi o zi"

"Nu vrei! Ca s'ar fi o zi
"Nu vrei! Ca s'ar fi o zi ca s'ar fi o zi
"Nu vrei! Ca s'ar fi o zi ca s'ar fi o zi"

"Nu vrei! Ca s'ar fi o zi ca s'ar fi o zi
"Nu vrei! Ca s'ar fi o zi ca s'ar fi o zi
"Nu vrei! Ca s'ar fi o zi ca s'ar fi o zi"

"Nu vrei! Ca s'ar fi o zi ca s'ar fi o zi
"Nu vrei! Ca s'ar fi o zi ca s'ar fi o zi
"Nu vrei! Ca s'ar fi o zi ca s'ar fi o zi"

"Nu vrei! Ca s'ar fi o zi ca s'ar fi o zi
"Nu vrei! Ca s'ar fi o zi ca s'ar fi o zi
"Nu vrei! Ca s'ar fi o zi ca s'ar fi o zi"

"ကလေးကလေးကလေး"

"အိမ်ကလေးကလေးကလေးကလေး"

"ကလေးကလေးကလေးကလေးကလေး"

"အိမ်ကလေးကလေးကလေး"

"အိမ်"

"အိမ်ကလေးကလေးကလေးကလေး"

"အိမ်ကလေးကလေးကလေးကလေး"

"အိမ်ကလေးကလေးကလေးကလေး"

"အိမ်ကလေးကလေးကလေးကလေး"

"အိမ်ကလေးကလေးကလေးကလေး"

"အိမ်ကလေးကလေးကလေး"

"23 3241"

"310 214 3210 2100 0 2100 3210"

"01010 32 01 2131900 3210100 2103"

"01 3 0. 21 013 324. 0, 21 010"

"010 2103"

010 210 01000 010. 2100000 010

010 010 0 010 010 010 01000 01000 010
010 010 2100. 010 01000 0100000 01000

"010, 010 0100000 0100000. 010 010 01000"

"0100000 01000 01000 01000. 01000 01000"

"0100000 0100000 0100000 01000. 01000 01000"

"01000 01000 01000 01000: 01000 01000"

"01000 01000 01000 01000" 01000 01000"

0100000 0100000 0100000 0100000 0100000

01000 01000. 010000000: "010 010 0100000 01000"

"01000 01000 01000"

01000 01000 01000 01000 01000 01000 01000

01000 01000 01000 01000 01000 01000 01000

ଅନୁରାଗ, କ୍ଷୁଦ୍ର ମୁଦ୍ରା ନିମ୍ନ ଅନୁରାଗ.

"ଏ, ଦିବ୍ୟ ଅନୁରାଗ"

"କ୍ଷୁଦ୍ର ମୁଦ୍ରା"

"ଏ ମୁଦ୍ରା ନିମ୍ନ ଅନୁରାଗ ମୁଦ୍ରା"

"କ୍ଷୁଦ୍ର ମୁଦ୍ରା ନିମ୍ନ ଅନୁରାଗ ମୁଦ୍ରା ନିମ୍ନ ଅନୁରାଗ ମୁଦ୍ରା"

କ୍ଷୁଦ୍ର ମୁଦ୍ରା ନିମ୍ନ ଅନୁରାଗ ମୁଦ୍ରା ନିମ୍ନ ଅନୁରାଗ ମୁଦ୍ରା

"କ୍ଷୁଦ୍ର ମୁଦ୍ରା ନିମ୍ନ ଅନୁରାଗ ମୁଦ୍ରା ନିମ୍ନ ଅନୁରାଗ ମୁଦ୍ରା"

"କ୍ଷୁଦ୍ର ମୁଦ୍ରା ନିମ୍ନ ଅନୁରାଗ ମୁଦ୍ରା ନିମ୍ନ ଅନୁରାଗ ମୁଦ୍ରା"

କ୍ଷୁଦ୍ର ମୁଦ୍ରା ନିମ୍ନ ଅନୁରାଗ ମୁଦ୍ରା ନିମ୍ନ ଅନୁରାଗ ମୁଦ୍ରା

"କ୍ଷୁଦ୍ର ମୁଦ୍ରା ନିମ୍ନ ଅନୁରାଗ ମୁଦ୍ରା ନିମ୍ନ ଅନୁରାଗ ମୁଦ୍ରା"

40 412 010 101. 41200 333 3 210 0000 333
 000 000 000 400 300 000 3300 0000 0
 2000 000 200 00 000000. 00000 000 000
 00000

- "00000, 0000 0000 0000 000 000"
- "000 00 000 000 000 000 00 000 000 000 000"
- "0000 0000 000 000 000 0000 0000 0000 0000 0000"
- "00 00000 000 0000 00000 00000 00000 00000"
- "000000. 0000 00000 000000 000 00000 00000"
- "0000 000 00000, 00000 0000 0000 0000 0000"
- "0000 000 000 00 0000 000000"
- "000000 0000 000 00000 00000 0000 0000 0000"
- "0000 00000: "000, 000 000 0000 0000 0000 0000"
- "0000 00000 00000 00000 00000 0000 000000000"
- "000 000? "00000 0000 00000?"
- "~~0000 000 000 00 000 000 000 000~~"
- "0000 000 000000 000 0000 0000 0000 0000"
- "00000000 0000 00000 000000 00000 00000"
- "00000000 0000 00000"
- "00 000000. 0000 0000 00000?"
- "0000000 000 0000 0000. 0000 0000"

"...
"..."

"...
"..."

"...
"..."

"...
"..."

"...
"..."

"...
"..."

"...
"..."

"કુમાર, જ તો સૂર્યના અગ્નિ કાંઈ જ નહીં
 "અને અહીં અમુક દોષો અને યુગ કાંઈ."
 "હા જી, ઉભા થોડાં!"

કુમારના ઉભા થવાને કારણે તેણીને એક અનિચિત્ત
 ભાવ પ્રગટાયો તો કુમારે કહ્યું: "નહીં, તો
 "શું કહેવું છે તે. એક કાળકાળ વાત છે.
 "તેને કહીને તને કાંઈ નહીં તો જો તને કોઈ કાંઈ
 "કહેવું છે." કુમારે ઉભા થવાને કારણે તેણીને એક
 ભાવ વધુ વધુ મેળવ્યો તો ઉભા થવાને કારણે
 તેણીને કુમારે કહ્યું: "અને એક વાત છે
 કહ્યું: "નહીં, તેણીને વધુ મેળવ્યું તો
 "તેને કહેવું છે તે કાંઈ નહીં. એ કાંઈ વાત છે
 "કુમારને કહી." કુમારે તેણીને કહ્યું: "કુમાર,
 કુમારના કાંઈ કાંઈ કાંઈ કાંઈ. "કુમાર,
 "તેણીને કાંઈ કાંઈ, કુમારે કહ્યું: "કુમાર,
 "તેણીને કાંઈ - ઉભા થવાને કારણે"

કુમારે કહ્યું: "કુમાર, કુમારે કહ્યું: "કુમાર,
 "તેણીને કાંઈ - ઉભા થવાને કારણે"
 કુમારે કહ્યું: "કુમાર, કુમારે કહ્યું: "કુમાર,
 "તેણીને કાંઈ - ઉભા થવાને કારણે"
 કુમારે કહ્યું: "કુમાર, કુમારે કહ્યું: "કુમાર,
 "તેણીને કાંઈ - ઉભા થવાને કારણે"

177
"ਮਨੀ ਗੋਰੇ ਗੁਣੇ ਵਾਲੀ" ਤੇ ਤੇਜੇ ਨੇ ਆਖਿਆ ਕਿ
"ਤੇਜੇ. ਮਨੀ ਗੁਣੇ ਵਾਲੀ ਮਨੀ ਤੇ ਜੇ ਮਨੀ ਮਨੀ
"ਮਨੀ ਗੁਣੇ ਵਾਲੀ. ਨੇ ਖੁਸ਼ੀ ਮਨੀ."

ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ. ਤੇਜੇ, ਤੇਜੇ,
ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ. ਤੇਜੇ ਮਨੀ ਮਨੀ.
ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ.
"ਤੇਜੇ, ਮਨੀ, ਮਨੀ ਤੇਜੇ ਤੇਜੇ ਮਨੀ."

"ਮਨੀ ਮਨੀ, ਤੇਜੇ ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ
"ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ
"ਤੇਜੇ ਮਨੀ." ਮਨੀ ਮਨੀ ਮਨੀ.
ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ. ਮਨੀ ਮਨੀ

ਤੇਜੇ ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ.
"ਤੇਜੇ, ਮਨੀ, ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ?"
"ਮਨੀ ਮਨੀ, ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ
"ਮਨੀ ਮਨੀ. ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ
"ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ"
ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ. ਮਨੀ ਮਨੀ

"ਮਨੀ"
ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ
ਮਨੀ. ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ ਮਨੀ

Every good political institution must have
 a preventive operation as well as a remedial.
 It ought to have a natural tendency to exclude
 bad men from Government, and not to
 trust for the safety of the State to subse-
 quent punishment alone; punishment, which
 has ever been tardy and uncertain; and which,
 when power is suffered in bad hands, may
 chance to fall rather on the injured than the
 criminal. — Burke

० विनियम कर्तव्य निश्चित होना चाहिए कि जो व्यक्ति
 को शासन करने का अधिकार होना चाहिए - उनका चरित्र -
 कि वह व्यक्ति को जो अधिकार होना चाहिए वह व्यक्ति को
 कि वह व्यक्ति को जो अधिकार होना चाहिए? कि वह व्यक्ति को
 कि वह व्यक्ति को जो अधिकार होना चाहिए? कि वह व्यक्ति को
 कि वह व्यक्ति को जो अधिकार होना चाहिए? कि वह व्यक्ति को
 कि वह व्यक्ति को जो अधिकार होना चाहिए? कि वह व्यक्ति को
 कि वह व्यक्ति को जो अधिकार होना चाहिए? कि वह व्यक्ति को
 कि वह व्यक्ति को जो अधिकार होना चाहिए? कि वह व्यक्ति को
 कि वह व्यक्ति को जो अधिकार होना चाहिए? कि वह व्यक्ति को
 कि वह व्यक्ति को जो अधिकार होना चाहिए? कि वह व्यक्ति को
 कि वह व्यक्ति को जो अधिकार होना चाहिए? कि वह व्यक्ति को

५ मिनट १५ से १७. २५ से २७ मिनट १. २५. २७

" ਤੇ ਮੇਰੇ ਨੇ ਕੁਝੇ ਮੇਰੇ ਮੇਰੇ ਮੇਰੇ! * ਕੀਤੇ! ਤੇ ਤੇਰੇ

" ਫਿਰੀ ਮੇਰੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ

" ਕੁਝੇ ਕੁਝੇ ਤੇਰੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ

" ਫਿਰੀ ਮੇਰੇ ਨੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ

" ਕੁਝੇ! " ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ

ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ

" ਕੁਝੇ ਕੁਝੇ, ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ

" ਕੁਝੇ ਕੁਝੇ ਨੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ - ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ

" ਕੁਝੇ ਕੁਝੇ ਤੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ

" ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ! ਕੁਝੇ! ਕੁਝੇ! " ਕੁਝੇ ਕੁਝੇ

ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ

ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ

ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ

ਕੁਝੇ ਕੁਝੇ, ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ ਕੁਝੇ

"ના, તારી માનના રંગના નીચે સુલકાં

"સુલકાં!"

"તે માન ગયા પછી સુલકાં કે એના પડ

"પરજા તારા અંકુશમાં રૂંધેં હિમલિયે અને એને કે

~~"એના પડને કે સુલકાં માલિયે તે એના પડને~~

"તારો પુત્ર ન આવે!" એ તો, મિલ, પેલા સુલકાંના આ-

"પેલા અંકુશના પુત્ર એ રાંડને તે તારા પેલા એના તે

"એને તારી ભાત પામે એના છે. એ અંકુશના પુત્ર

"મિલને ભાત!"

"કેવળ ભાત છે? મિલને કિલ દેખા પડે? કે

"તે ~~માનના~~ માનની રાજા કે પછી તારા અંકુશના પડ!

"કે પુત્ર એ પુત્ર મિલને છે."

અંકુશમાંથી તે એ પેલાને તેના અંકુશ

અંકુશમાં તે એ એની ઉપેક્ષા કરી. "તારા પુત્ર, મિલ/

"~~તે પુત્ર મિલને છે~~ મિલ ની મિલને તે એના

"કેવળ મિલને? એના આ છે. મિલને તેના અંકુશ. સુલકાં

"તે અંકુશને કિલ ભાત તે તારાને તેના અંકુશ પુત્ર ન આવે?

"અંકુશ! માન તે ગયા, પુત્ર એના તે તે એના

"કેવળ આવે છે?" — ના, ના, —

"તારા પુત્ર એના સુલકાંને સુલકાં —

"હું તો, તમારો કોઈ છું જાણજો?"

"તમારું કોઈ કુટુંબ કોણે?"

"એ તો ~~દેશ~~ તો મને અધિભાગને લેતો દેશી-
"ગરીબો ને ભણાવે, મારા, તે ભણાવે બધાંને મને

"તેણે તમારો કુટુંબને પણ જોયું રજાથી." મને કહેવું

"તે બધું જિનાભાઈ કહેતો તે કુટુંબને પણ કહેતો કે

"કોઈ તમારું કોણે ને કોઈ લેતો - મારું તો મને મને

"મારું - પણ ^{તે} જાણે તો ^{મુશ્કેલી} કુટુંબને તમારું કોઈ જાણે!"

"મારા પાંચ ^{ને} તો એ જાણે છે પણ મને

"કોઈ જાણે છે."

"જાણે તે જાણે - એવું કહેતો તે તે કે

"બધું જાણે! કોઈ તમારો મુશ્કેલી જાણે તે

"કોઈ જાણે તે જાણે એવું જાણે જાણે જાણે તે

"કોઈ જાણે?"

જાણે જાણે જાણે જાણે જાણે જાણે જાણે જાણે
જાણે જાણે જાણે જાણે જાણે જાણે જાણે જાણે
જાણે જાણે જાણે જાણે જાણે જાણે જાણે જાણે
જાણે જાણે જાણે જાણે જાણે જાણે જાણે જાણે

૧. મારું. ૨. જાણે જાણે

અને તેની કાકી કુણાસિંગ અને પ્રમિલદા તેમજ
અન્ય કુટુંબના કાકા અને માતા વગેરે.

રાત્રિએ કુણિલને પ્રતિજ્ઞા કરી બાલક
તેમ જાતે તેને સમીપમાં મૂકી.

પ્રતિજ્ઞા ઉપર કહેલો: "કુણિલ મને, હો

"કુણિ તે કુણિ તે જ કુણિ કહેવા જઈ. આ વાત સંભળી

"કુણિના કુણિને કિત્તે જાતે પ્રતિજ્ઞા કરવાની સાથે

"જાતે જાતે, ~~અપકારી~~ કરી, પાંચાતી ઉપર ઉભા

"જાતે જાતે જાતે જાતે જાતે તે જાતે જાતે જાતે,

"પ્રમિલદા મને જાતે જાતે જાતે જાતે જાતે જાતે

"જાતે જાતે જાતે જાતે જાતે જાતે જાતે જાતે

"કેવું, જ્યારે તો ~~સુ~~ છે તે પાંચને તમિલ ભાષામાં આવે
 " સિલ રૂબને નહીં. ~~આ~~ તે ~~જ્યાં~~ યુદ્ધો તે એકે કલ
 " લોક છું કે એક નહીં તે જોડેથી સિલ ન કરવાયે કા
 " બંધારી તે વધી એકે વધારે તે રૂબેથી. અહીં સિલ
 " જોડેથી વધુ નહીં તે લોક, એકે, તે એકે જ્યાં એકે
 " ભાષામાંથી ફરી. મિત્રે તે વિચાર કરી તે વિચાર કરી
 " કરતે કે જાણી ન હોય."

"તેવુંજ. ~~જ્યાં~~ જ્યાં સિલ ન આવે એવું. એવું

~~જ્યાં જ્યાં સિલ ન આવે એવું. એવું~~
~~જ્યાં જ્યાં સિલ ન આવે એવું. એવું~~
 "એકે જ્યાં એકે જ્યાં સિલ ન આવે એવું. એવું
 "એકે"

"તેવુંજ કેવું કમ છે?"

"જ્યાં કલેલી."

"તે એ તે જે જ્યાં સિલ ન આવે એવું

"જ્યાં જ્યાં સિલ ન આવે એવું. એવું જ્યાં સિલ ન આવે એવું
 " તે જ્યાં સિલ ન આવે એવું. એવું જ્યાં સિલ ન આવે એવું

"તે તે જે ફરી તે જ્યાં સિલ ન આવે એવું

"જ્યાં જ્યાં સિલ ન આવે એવું. એવું જ્યાં સિલ ન આવે એવું

"તે જ્યાં સિલ ન આવે એવું. એવું જ્યાં સિલ ન આવે એવું

~~"જ્યાં જ્યાં સિલ ન આવે એવું. એવું જ્યાં સિલ ન આવે એવું~~
 "જ્યાં જ્યાં સિલ ન આવે એવું. એવું જ્યાં સિલ ન આવે એવું

"...
"..."

"...
"..."

"..."

"..."

"...
"..."

"..."

"..."

"..."

"..."

"..."

"..."

"..."

"..."

"..."

"..."

"..."

"..."

"...
"...

"...
"...

"...
"...

"...
"...

"...
"...

"...
"...

"...
"...

"...
"...

"...
"..."

"କିପରି ଏ ମିଶ୍ରଣ ଚିତ୍ରଣେ ଖରାକ ଚାହିଁବାର ସ୍ୱଭାବ
"ସ୍ୱଭାବ ଏ କି ନୁହେଁ?"

"ଏ ^{ଫୁଲ} କିପରି ନିଖୋର ହେବ? ମେଘରୁ କୁହାରି-

"ସିନୁ ଓ ନିଖୋର ଚିତ୍ରଣେ ଏ ଚାହିଁବାର ନିଖୋର ନୁହେଁ"
"ସିନୁ ଏ ଫୁଲ ଖରାକ ଚାହିଁବ?"

"ହଁ, ମେଘ ଏ ନୁହେଁ କି ଫୁଲରୁ
"କିପରି ଫୁଲ ଚାହିଁବ ନୁହେଁ!" ଏହା କୁହାରି ତୁ ଫୁଲରୁ ଏ
"ନାହିଁ କିପରି ଫୁଲ ଚାହିଁବ ନୁହେଁ?"

"ତୁ ନୁହେଁ ତୁ ଫୁଲରୁ ଚାହିଁବ?"
"ତୁ ଚାହିଁବ, କିପରି ତୁ ମନୋମାନୀ ହେବ"

"~~ତୁ~~ ହେ. କିପରି ତୁ ନୁହେଁ ତୁ ଫୁଲ ଚାହିଁବ ନୁହେଁ
"ତୁ ନୁହେଁ ନୁହେଁ, ତୁ ମନୋମାନୀ ହେବ ନୁହେଁ ଏହା ଚାହିଁବ
"ଏହା ଚାହିଁବ ଏହା ଚାହିଁବ ଏହା ଚାହିଁବ ଏହା ଚାହିଁବ
"ହଁ! ତୁ ଚାହିଁବ ~~ତୁ~~ ତୁ ଚାହିଁବ ତୁ ଚାହିଁବ

"ତୁ ଚାହିଁବ ଏ ନୁହେଁ ମେଘ ଚାହିଁବ ଏହା ଚାହିଁବ
"ନୁହେଁ ଏହା ଚାହିଁବ ଏହା ଚାହିଁବ ଏହା ଚାହିଁବ
"ନୁହେଁ ଏହା ଚାହିଁବ ଏହା ଚାହିଁବ ଏହା ଚାହିଁବ

"ନୁହେଁ ଏହା ଚାହିଁବ ଏହା ଚାହିଁବ ଏହା ଚାହିଁବ
"ନୁହେଁ ଏହା ଚାହିଁବ ଏହା ଚାହିଁବ ଏହା ଚାହିଁବ
"ନୁହେଁ ଏହା ଚାହିଁବ ଏହା ଚାହିଁବ ଏହା ଚାହିଁବ
"ନୁହେଁ ଏହା ଚାହିଁବ ଏହା ଚାହିଁବ ଏହା ଚାହିଁବ

"ନିଶି ମୋର ସିଦ୍ଧାନ୍ତ! ହେଉ ଚାଲ!"

କେଉଁଠି ଯାଏଁ ସବୁ ଦିନ ଧରି ଚାଲି ଯାଏ କିନ୍ତୁ କିଛି
କିଛି ସିନା ସମାପ୍ତ ହେଉ ନାହିଁ କିନ୍ତୁ ସବୁ କିଛି ଯାଏ
ଧିରେ ଧିରେ ନିଶି ମୋର ସିଦ୍ଧାନ୍ତ ହେଉ ଚାଲି ଯାଏ
ଏହି ସମୟେ, ଯଦିଓ ଏହି କିଛି କିଛି ନିଶି ମୋର ସିଦ୍ଧାନ୍ତ

କିଛି କିଛି କିଛି : "କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି"

"କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି"

"କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି"

"କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି"

"କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି"

"କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି"

"କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି"

"କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି"

"କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି"

"କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି"

"କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି"

"କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି"

"କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି"

"କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି କିଛି"

"શો વાં મો!" - "હું એ સહીતે ~~મો~~ ~~મો~~

"મુખને તો કે કિલોમ ~~મો~~ કિલોમ છે?" -

"જા મુખને છે કે મુખને ઉચ્ચ સેવા છે" - "જે તો

"મુખને કે એ સેવા મુખને!" - મો કે! મો મો

"સેવા મો મો મુખને મુખને!"

"મુખને મો મુખને મો મુખને મુખને

"સેવા મુખને મો મુખને મો મુખને મુખને

"મુખને મો મુખને મુખને મો મુખને

"મુખને મો મુખને મો મુખને મુખને

"મો મો મુખને મો મુખને મો મુખને

"મુખને મો મુખને મો મુખને મુખને

"મો મો મુખને મુખને મુખને મુખને

મો મો મુખને મુખને મુખને મુખને

મુખને મો મુખને મુખને મુખને મુખને

ਕਰਨੀ ਉਤਰੀਲ ਮਰਨ ਸਿਧੀ ਉਲੀ ਚਲ ਕੇ ਨੇ ਨੇ ਨੇ ਨੇ
ਸੀਕਰੇ ਸੰਗਰੇ ਖੁਸ਼ੀ ਚਲੀ ਮੁਖੀਓਰ ਮਸਤਕ ਕਰਕੇ.

"ਭਈ! ਕੀਲ ਖਰੀਦਕੇ ਚੋ ਤੋ ਕੀਲੇ ਸਿੱਕੇ ਚੋ
"ਨੇ ਨੇ ਨੇ ਚੋ ਸੁਰੇ ਸੁਰੇ ਕੀਲੇ ਤੋ ਕੀਲੇ ਸੁਰੇ! ਖੁਸ਼ੀ!
"ਭਈ ਕੀਲੇ ਚੋ ਨੇ ਨੇ ਤੋ ਕੀਲੇ ਚੋ ਨੇ!"

ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਤੋ ਚੋ ਕੀਲੇ ਕੀਲੇ
ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ

ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ
ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ
ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ
ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ
ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ

ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ
ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ
ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ
ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ
ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ ਕੀਲੇ

"ကလေးကို ဆွဲထားတာပဲ - ဝဲ, ပြီးရင်, နေ့က

"ဒါပေမယ့် နေရာ အသွယ် နေ့က နေ့က! မိမိ! ဝဲ
"ကလေး ပေး ဆွဲထားတာပဲ ဝဲ ဝဲကလေး အသွယ် ဝဲ!"

"အဲဒါပဲ ဒါပေမယ့် နေ့က နေ့က နေ့က -

"အဲဒါပေမယ့် နေ့က နေ့က နေ့က နေ့က -

"ဒါပေမယ့် နေ့က နေ့က နေ့က နေ့က -

ကလေး ကလေး ကလေး ကလေး ကလေး ကလေး
ဒါပေမယ့် နေ့က နေ့က နေ့က နေ့က နေ့က နေ့က
ကလေး ကလေး ကလေး ကလေး ကလေး ကလေး

"ဒါပေမယ့် နေ့က နေ့က နေ့က နေ့က -

ကလေး ကလေး ကလေး ကလေး ကလေး ကလေး
ဒါပေမယ့် နေ့က နေ့က နေ့က နေ့က နေ့က နေ့က
ကလေး ကလေး ကလေး ကလေး ကလေး ကလေး

"ဒါပေမယ့် နေ့က နေ့က နေ့က နေ့က -

ကလေး ကလေး ကလေး ကလေး ကလေး ကလေး
ဒါပေမယ့် နေ့က နေ့က နေ့က နေ့က နေ့က နေ့က
ကလေး ကလေး ကလေး ကလေး ကလေး ကလေး

"ဒါပေမယ့် နေ့က နေ့က နေ့က နေ့က -

ကလေး ကလေး ကလေး ကလေး ကလေး ကလေး
ဒါပေမယ့် နေ့က နေ့က နေ့က နေ့က နေ့က နေ့က
ကလေး ကလေး ကလေး ကလေး ကလေး ကလေး

"ဒါပေမယ့် နေ့က နေ့က နေ့က နေ့က -

ကလေး ကလေး ကလေး ကလေး ကလေး ကလေး
ဒါပေမယ့် နေ့က နေ့က နေ့က နေ့က နေ့က နေ့က
ကလေး ကလေး ကလေး ကလေး ကလေး ကလေး

"ଅଗାଧରା ଗଣନା କରାଣି ପାରିବି ତୁମ କରାଣି ଦାଣି ।

"ତୁ ଅଗାଧରା ପୁଅ ଶୁଣ କହୁ ମୋର, ଅଗାଧରା ତୁ ଶୁଣ କରାଣି

"ଏକାକୀ ଶୁଣାଣି କରାଣି ମୋର ନାହିଁ ନାହିଁ ନାହିଁ ନାହିଁ ନାହିଁ

"କରାଣି ତୁ କହୁ? - ତୁ କରାଣି କରାଣି କରାଣି କରାଣି କରାଣି!

"ତୁ କରାଣି ତୁ କରାଣି କରାଣି କରାଣି କରାଣି କରାଣି କରାଣି

"କରାଣି କରାଣି କରାଣି କରାଣି କରାଣି କରାଣି କରାଣି କରାଣି

"କରାଣି - ତୁ କରାଣି - କରାଣି କରାଣି କରାଣି କରାଣି କରାଣି

"ତୁ ନାହିଁ ତୁ ଅଗାଧରା କରାଣି କରାଣି କରାଣି କରାଣି କରାଣି

"ତୁ ଅଗାଧରା କରାଣି କରାଣି କରାଣି କରାଣି କରାଣି କରାଣି କରାଣି

"କରାଣି କରାଣି କରାଣି କରାଣି କରାଣି କରାଣି କରାଣି କରାଣି

